



Sanctioned Under Government Notification Urban Development and Urban Housing
Department NO.GH/V/ 98 of 2017/ TPS- 112014- 4855- L, Dtd. 20/05/2017

FINAL PLOT NO:- 893



RECONSTITUTED AREA BOUNDARY



Note:- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration .

નોંધ:- આ ફક્ત ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોડકાઈનની અસર/ ઝોનિંગ વિગેરે બાબતો અંગે રીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન/ અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

અરજદાર દ્વારા ઇ.નં. P201K0130/1213 તા. 30/01/2018 થી
નકલની માંગણી કરેલ હોઈ પહોંચ નં. 733/183 તા. 30/01/2018
રો. 1-0-01 વસુલ લઈ નકલ આપવામાં આવેલ છે.

 O.P BOUNDARY
 F.P BOUNDARY
 ROAD
 T.P.S BOUNDARY

31/1/2018

Chd. By:

Low H. D' man:

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD

PART PLAN SHOWING

F.P. NO.:- 776

T.P.S. NO. & NAME :- 28_NEW WADAJ

DISTRICT:- AHMEDABAD


LEGEND

-  Residential Zone I-R1
-  Village Boundary
-  TPS Boundary
-  Existing Road
-  Proposed Road



1 c.m. = 20 mt.

Part plan as per Second Revised Development Plan 2021 Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.) by the Urban Development & Urban Housing Department- Govt. of Gujarat vide its Notification No.GH/V/207 of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.



This part plan is certified for the F.P. NO. :- 776

- NOTE :-**
- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.
 - (2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.:-RP2018.0130/770
Amount Recieved Rs. 1000/-
Receipt No. 733/82/ Dtd 30/1/2018.

TRUE COPY

Prep. By:

Chd. By:

H. D' man:

**TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDBAD MUNICIPAL CORPORATION
AHMEDABAD.**



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, મધ્યસ્થ કચેરી,

મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧. ગુજરાત.

Website:- www.ahmedabadcity.gov.in

અરજી ક્રમાંક :- RZ20180130/771

અરજી તા.:- ૩૦/૦૧/૨૦૧૮

પરિણે નં.:-૭૩૩/૮૧ તા.:- ૩૦/૦૧/૨૦૧૮.

અરજદારશ્રી પરેશ રાણા,

સેટેલાઈટ, અમદાવાદ.

ઝોનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ની કલમ- ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અન્વયે રાજ્ય સરકારશ્રીનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં જાહેરનામા ક્રમાંક GHV/207 OF 2014/ DVP-112013-4777-L, તા.:-૨૦/૧૨/૨૦૧૪થી અમલમાં આવેલ ઔડા દ્વારા તૈયાર થયેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૨૧ મુજબનાં નકશાનાં આધારે.

ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. :- ૨૮- નવા વાડજ (ફાઇનલ)

ફાયનલ પ્લોટ નં. :- ૭૭૬

રી.ડી.પી. શીટ નં. :- ૭૭

ની જમીનની પશ્ચિમેથી પસાર થતો ૧૮.૩૦ મી. નો રસ્તો ૩૦.૦૦ મી.નો પહોળો થાય છે, તેની અસર થાય છે, બાકી રહેતો ભાગ રહેણાંક ઝોન-૧ (એક) R1 માં આવે છે.

નોંધ:

૧. આ ફક્ત ઝોનિંગ સર્ટિફિકેટ છે, બાંધકામની પરવાનગી નથી.

ખરી નકલ

તા. ૩૧/૧/૨૦૧૮.

જ. ફાફ્ટસમેન + ડી. ફાફ્ટસમેન

ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ.